




અમદાવાદ મહાનગરપાલિકા  
અમદાવાદ  
સેન્ટ્રલ ઓફીસ ખાતુ  
માહિતી (મેળવવાનો) અધિકાર  
અધિનિયમ - ૨૦૦૪



પ્રકરણ-૨ નિયમ ૪(૧)ખ ની જોગવાઈ મુજબ  
શ્રી.સી આર ખરસાણ, આઈ.એ.એસ  
ડૉ.ભૂનિસિપલ કમિશનર(વહીવટ)

ફોન ઓફીસ : ૨૫૩૮૯૮૫૪ Ext. ૫૫૦



**અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન, મુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફિસ**  
**પ્રકરણ ૩ (નિયમ સંગ્રહ - ૨) અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો.**

અનુક્રમ	હોદ્દો / નામ / એમલોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંષાકીય સત્તા	અન્ય	ફરજો
૧.	મુનિસિપલ કમિશનર શ્રી મુકેશ કુમાર આઈ.એ.એસ.	બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૮ મુજબ	ઓફર/કવોટેશનની સત્તા શિડ્યુલ ચેપ્ટર-૪ રૂલ-૨(૨) મુજબ રૂ. ૩૦૦૦૦/- ટેન્ડરની સત્તા કલમ ૭૩(ક) મુજબ રૂ. ૧૫૦૦૦૦/-	-	મુનિ. કોર્પો.નાં સર્વોચ્ચ વહીવટી વડા હોવાથી મુ. કોર્પોનો તમામ વહીવટ તેઓના નામે ચાલે છે.
૨.	૩. મુનિસિપલ કમિશનર (વહીવટ) શ્રી સી આર ખરસાણ, આઈ.એ.એસ	<ul style="list-style-type: none"> <li>❖ સેન્ટ્રલ ઓફિસના કર્મચારીઓની સર્વિસબુક રીઓપન કરવા</li> <li>❖ સેન્ટ્રલ ઓફિસના કર્મચારીના બાકી મુનિસિપલ લેણાં નિવૃતીના લાભોમાંથી વસ્તુલ લેવા</li> <li>❖ સેન્ટ્રલ ઓફિસના કર્મચારીના સ્ટેર્ગ ઇન્ક્રીમેન્ટ મંજૂર કરવા</li> <li>❖ સેન્ટ્રલ ઓફિસના કર્મચારીએ સીક્યુરિટી બોન્ડ ન આપેલ હોય તો વેવ કરવા તેમજ તીલે કોન્ડોન કરવા</li> <li>❖ કોર્પોરેશનની નીતી અનુસાર કર્મચારીઓના મેડિકલ રીએમ્બ્સમેન્ટ બીલોની ચૂકવાણી માટે મંજૂરી આપવી</li> <li>❖ ડ્રાઇવરોના ઓપરટાઈમની મંજૂરી</li> </ul>	<ul style="list-style-type: none"> <li>ઓફર/કવોટેશનની સત્તા શિડ્યુલ ચેપ્ટર-૪ રૂલ-૨(૨) મુજબ રૂ. ૧૨૫૦૦/- ટેન્ડરની સત્તા કલમ ૭૩(ક) મુજબ રૂ. ૫૦૦૦૦/-</li> </ul>	-	<p>સેન્ટ્રલ ઓફિસ સહીતની મુ. કોર્પોની કોમન કેડરની વ્યવસ્થા પર્સિનલ પોલીસી, માનવ સંસાધન વિકાસ, ઓફિસર તથા કર્મચારીઓની ટ્રેઇનિંગ સંબંધીત કામગીરી</p> <p>મુનિસિપલ કમિશનરશી દ્વારા અપાયેલ મંજૂરી સંદર્ભે ભરતી, બઢતી તથા બદલીની કાર્યવાહી કરવી.</p>
૩.	આસી.મેનેજર શ્રી નિલેષ સી. પટેલ એમલોઈ નં. ૭૦૨૨૮	<ul style="list-style-type: none"> <li>❖ શિરસેટાર બ્રાંચ</li> <li>❖ હેડ કલાર્ક (જનરલ), ૨૪૪સ્ટ્રી બ્રાંચ</li> <li>❖ સંકલન વિભાગ (બોર્ડ/કમિટી)</li> <li>❖ રોસ્ટર વિભાગ</li> <li>❖ હેડ ડ્રાઇવર</li> </ul>	<ul style="list-style-type: none"> <li>❖ રૂ. ૨૫૦/- સુધીનો કન્ટીજન્સી ખર્ચ કરવાની સત્તા</li> <li>❖ રૂ. ૨૫૦/- સુધીના</li> </ul>	ખાતાવિકારી તરફથી સૌંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સેન્ટ્રલ ઓફિસની જીડીએસટી નં. ૮૫૦૭ મુજબની બ્રાંચોની ફાઈલોની ચકાસણી કરીને સક્ષમ સત્તા સમક્ષ મંજૂરી અર્થે મુકવાની કામગીરી

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્પલોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંશાકીય સત્તા	અન્ય	કૃજો
		<ul style="list-style-type: none"> <li>❖ કંટ્રોલરૂમ</li> <li>❖ સેન્ટ્રલ ઓફીસના ડેડકલાર્ક, શિરસ્ટેદાર, સંકલન અધિકારીશ્રી ઉપર વહીવટી દેખરેખ</li> <li>❖ સેન્ટ્રલ ઓફીસના સ્ટાફની સાત દિવસની કેજયુઅલ ૨જી મંજૂર કરવાની સત્તા</li> <li>❖ કામગીરી સંતોષકારકનું સર્ટિફીકેટ આપવા</li> <li>❖ ગેજેટ તથા મેમોરેન્ડમ ઓફ મેરેજ, એફિલેવિટના આધારીત કર્મચારીઓના નામમા ફેરફાર કરવાના ઠરાવ કરવાની</li> <li>❖ ફરજના સમય અથડામણમાં આવતો ન હોય તો કર્મચારીઓને વધુ અભ્યાસ કરવાની મંજૂરી આપવાની</li> <li>❖ નો ઓફ્જેક્શન સર્ટિફીકેટ ઈસ્યુ કરવાની</li> <li>❖ ભુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી મળ્યા બાદ ઠરાવ ઈસ્યુ કરવાની</li> <li>❖ કર્મચારીઓની અન્ય સંસ્થામાં અરજી ફોરવર્ડ કરવાની</li> </ul>	એડજસ્ટમેન્ટ ખર્ચના		
૪.	આસી.મેનેજર શ્રી ડિરાષ્ટકુમાર જે. વનાલીયા એમ્પલોઈ નં. ૭૦૨૪૫ (ફાળવણીથી નિમણૂંક)	<ul style="list-style-type: none"> <li>❖ ઈન્ટરબ્યુ બ્રાંચ</li> <li>❖ વેલ્ક્રેર બ્રાંચ</li> <li>❖ સિલ્વિરીટી બ્રાંચ તેમજ સેમીનાર તાલીમ</li> <li>❖ બીલકલાર્ક અને ઈમ્પ્રેશ કેશ</li> <li>❖ વોયેન</li> <li>❖ ઈન્ક્ઝિમેન્ટ મંજૂર કરવાની સત્તા (ડેડકલાર્ક, શિરસ્ટેદાર, સંકલન અધિકારી, ઓ.એસ., તેમજ વેલ્ક્રેર ઓફીસર સિવાય)</li> <li>❖ ખર્ચની મંજૂરી મળેલ બિલોમા ખાતાના અધિકારી તરીકે સહી કરવાની</li> </ul>	<ul style="list-style-type: none"> <li>❖ રૂ. ૨૫૦/- સુધીનો કાન્ટીજન્સી ખર્ચ કરવાની સત્તા</li> <li>❖ રૂ. ૨૫૦/- સુધીના એડજસ્ટમેન્ટ ખર્ચના</li> </ul>	ખાતાધિકારી તરફથી સૌંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સેન્ટ્રલ ઓફીસની જીડીએસ્ટી નં. ૮૫૦૭ મુજબની બ્રાન્ચોની ફાઈલોની ચકાસણી કરીને સક્ષમ સત્તા સમક્ષ મંજૂરી અર્થે મુકવાની કામગીરી

અનુક્રમ	હોદ્ડો / નામ / એમ્બ્લોઈંગ નંબર	વહિવટી સત્તાઓ	નંશાકીય સત્તા	અન્ય	ફરજો
૫.	શિરસેદાર શ્રી ભરતભાઈ આર. સોલંકી એમ્બ્લોઈંગ નં. ૮૬૮૪			ખાતાવિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશનના તમામ ખાતાઓની વર્ગ ૧ થી ૪ ના અધિકારીઓ / કર્મચારીઓની નિમણું બદલી અને બઢતી અંગેની કામગીરી, ખાનગી અહેવાલ બ્રાન્ચની કામગીરી, ડીપાર્ટમેન્ટલ પરીક્ષાની કામગીરી, એસ્ટાબ્લીસમેન્ટ બ્રાન્ચની કામગીરી, કર્મચારીઓ / અધિકારીઓને ટ્રેનિગમાં મોકલવા અંગેની કામગીરી
૬.	સંકલન અધિકારી (બોર્ડ - કમિટી) શ્રી કાંતિભાઈ બી પ્રજાપતિ એમ્બ્લોઈંગ નં. ૮૦૫૧			ખાતાવિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ખુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી કમિટીઓ, સ્ટે.કમિટી તથા ખુનિસિપલ બોર્ડમાં સંકલનની કામગીરી તથા કમિટી તથા બોર્ડમાં હાજર રહેવું. તેમજ ખુનિસિપલ કાઉન્સીલરશી દ્વારા ખુનિસિપલ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો જે તે ખાતામાં મોકલી જે તે ખાતા મારફતે સક્ષમ સત્તાની મંજૂરી મેળવી જવાબ કરવાની કાર્યવાહી કરવી. તેમજ રોસ્ટરબ્રાંચને લગતી માહીતી રાજ્ય સરકારમાં મોકલવી.
૭.	વેલ્કેર ઓફીસર/એ.એસ શ્રી. રઘુભાઈ એન. પાંડોર એમ્બ્લોઈંગ નં. ૮૫૭૮			ખાતાવિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ચાલુ ફરજ દરમાન અવસાન પામનાર વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારીના આશ્રિતને રાજ્ય સરકારના નીતિ નિયમો અનુસાર નાણાંકિય સહાય આપવા મંજૂરી મેળવવાની કામગીરી તથા મેનહોલ/ગલીટ્રેપ ખાતાના વર્ગ-૪ના કર્મચારીઓના મરણ/અનફિટ કેસમાં નોકરી આપવા અંગે તથા આનુષાંગિક કાર્યવાહી, લેડીજરમ તથા ધોરીયાધરની દેખરેખની તથા માલસામાન પૂરી પાડવાની કામગીરી, ઈમ્પ્રેશ કેશના બીલો ચેક કરવાની કામગીરી, સેન્ટ્રલ ઓફિસ ખાતે ફરજ બજાવતા વર્ગ ૧ થી ૪ કર્મચારીઓના પગાર બીલોની માહીતી તથા સીક્યુરીટી બ્રાંચની કામગીરી
૮.	એ.એસ. (ઇન્ટરવ્યુ બ્રાંચ) શ્રી વિજયભાઈ આર પટેલ એમ્બ્લોઈંગ નં. ૮૪૮૮			ખાતાવિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ઇન્ટરવ્યુ બ્રાંચની કામગીરી ખુનિ. કોર્પો. દ્વારા કરવામાં આવતી તમામ ભરતી અંગેની સક્ષમસત્તાની મંજૂરી મેળવી જાહેર ખબર આપવી તથા લેખિત તેમજ મૌખિક પરિક્ષા લેવી, ઉમેદવારના સર્ટીચેક કરવા તથા નિમણુંકના હુકમ તૈયાર કરવા તથા વહિવટી સુધારણા સેલની કામગીરી
૯.	હેડકલાર્ક (ઇન્ટરવ્યુ બ્રાંચ) શ્રી મનહરભાઈ એમ રાઠવા એમ્બ્લોઈંગ નં. ૮૮૮૮			ખાતાવિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન ખાતાના જુદા જુદા ખાતાની ખાતાની માંગણી મુજબ જગ્યાઓ જાહેર ખબર આપી ભરવા મંજૂરી મેળવી જાહેર ખબર આપવાની કાર્યવાહી કરવી, જાહેર ખબરના અનુસંધાને આવેલ અરજીઓની લાયકાત મુજબ ચકાસણી કરવાની, તેમજ તે અંગે સક્ષમ સત્તાની મંજૂરી મેળવી ઇન્ટરવ્યુ ગોઠવવાની કામગીરી, ઇન્ટરવ્યુમાં આવેલ ઉમેદવારોના અસલ સર્ટીફિકેટ ચેક કરવાની કામગીરી, તેમજ ઇન્ટરવ્યુ બાદ સ્ટાફ સિલેક્શન કમિટીની સૂચના મુજબ પસંદગીયાઈ / પ્રતિક્ષાયાદી બનાવી સ્ટાફ સિલેક્શન ઠરાવ પાડવાની કામગીરી

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્લોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંશાકીય સત્તા	અન્ય	ફરજો
૧૦.	હેડકલાર્ક શ્રી સોમભાઈ જી રાઠવા એમ્પ.નં-૮૫૫૧			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	સેન્નીગ તથા હેડકલાર્ક(જનરલ)ની રજા દરખાન તથા મદદની કામગીરી તથા હેડ કલાર્ક (સીક્યુરીટી)શ્રીની મદદમાં કામગીરી
૧૧.	હેડ કલાર્ક (રોસ્ટર) શ્રી સોમભાઈ જી રાઠવા એમ્પ.નં-૮૫૫૧			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	ભૂનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતાઓમાં આવેલ વર્ગ ૧ થી ૪ ની જગ્યાઓના રોસ્ટર રજીસ્ટર નિભાવવા, સેમીનાર અંગે દરખાસ્ત કરવી, રાજ્ય સરકાર દ્વારા રોસ્ટરના અનુસંધાને માંગવામાં આવતી માહીતી નિયત ફોર્મમાં સક્ષમ સત્તાની મંજૂરી મેળવી પૂરી પાડવી.
૧૨.	ઈન્ચાર્જ હેડકલાર્ક (જનરલ) શ્રી વિજય કે પંડ્યા એમ્પ.નં ૮૧૬૧			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	ભૂનિસિપલ કમિશનરશ્રી તથા ૩.ભૂનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને આવતી ટપાલો સંબંધિત ૩.ભૂનિસિપલ કમિશનરશ્રી સમક્ષ મુકવાની કામગીરી, સેન્ટ્રલ ઓફિસના કર્મચારીઓના હક્કરજા, સી.એલ, હાજરીપત્રકનું સુપરવીઝન, તથા સેન્ટ્રલ ઓફિસના સરકારી પત્રોના જવાબ કરવાની કાર્યવાહી,
૧૩.	હેડ કલાર્ક (શ્રી પાંચલભાઈ વસાવા-ફાળવણી) સીક્યુરીટી બ્રાંચ એમ્પ.નં-૮૪૮૮			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેશનની મિલકતો, નાકાઓ, જોનલ ઓફિસો વગેરેની દેખરેખ અને સાચવણી માટે સીક્યુરીટી કંપનીઓને કોન્ટ્રાક્ટથી રાખવામાં આવે છે. તે સીક્યુરીટી કંપનીના બીલોની પોઇન્ટ વાઈજ ચકાસણી કરીની બીલની મંજૂરી મેળવવાની તેમજ મંજૂરી મળે તેને પેમેન્ટ કરવાની કામગીરી
૧૪.	સીનીયર કલાર્ક (સંકલન) ધીરેન કે.શાહ એમ્પ.નં-૬૭૮૫			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	ટાઉન પ્લાનીગ કમિટી, એસ્ટેટ કમિટી, હાઉસીગ કમિટી, રીકીએશન કમિટીમાં સંકલનની કામગીરી
૧૫.	સીનીયર કલાર્ક (સંકલન) બણદેવભાઈ ડી.ડેસાઈ એમ્પ.નં-૬૮૦૦			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	હેલ્પ એન્ડ સોલીડ વેસ્ટ કમિટી, હેલ્પ કમિટ, હોસ્પિટલ કમિટી, રેવન્ચુ કમિટી, વોટર સપ્લાય કમિટી, રોડ અને બિલીગ કમિટી તથા લીગલ કમિટીમાં સંકલનની કામગીરી
૧૬.	સીનીયર કલાર્ક (સીક્યુરીટી બ્રાંચ) શ્રી શૈલેષભાઈ કે મોડી એમ્લોઈ નં. ૬૮૨૦			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	જુદી જુદી સીક્યુરીટી કંપનીના આવતા બીલોની પોઇન્ટ વાઈજ ચકાસણી કરીને ખતવણી કરવાની કામગીરી, બીલોનું સ્ટેટમેન્ટ બનાવવાની કામગીરી, જરૂરીયાત મુજબ જે તે જગ્યાએ સીક્યુરીટી મુકવા તેમજ બંધ કરવા સીક્યુરીટી કંપનીને જાણ કરવા તેમજ એસ્ટેટ / ટી.ડી.ઓ ખાતા દ્વારા ગેરકાયદેસર બાંધકામ માટે મુકવામાં આવતી સીક્યુરીટી અંગેનો ચાર્જ વસૂલ દેવા અંગેની ગણતરી કરી ટી.ડી.ઓ / એસ્ટેટ ખાતાને જાણ કરવી.તેમજ બીલો બનાવવા.
૧૭.	જુનીયર કલાર્ક શિરસ્ટેદાર બ્રાંચ શ્રી ભુમિકા પી દેસાઈ એમ્લોઈ નં. ૬૬૩૭			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	આસી.મેનેજરશ્રી (સે.ઓફિસ) તથા શિરસ્ટેદારશ્રી (સેન્ટ્રલ ઓફિસ)ને સંબોધીને આવતી ખાતાવિકી તથા સરકારી અરજાઓ, ટપાલ, તથા ફાઈલોનું ઈન્વર્ટ આઉટવર્ટ પોસ્ટેજ રજીસ્ટર તથા ઈન્ટરવ્યુ બ્રાંચની ટપાલની કામગીરી

અનુક્રમ	હોદ્દો / નામ / એમલોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંશાકીય સત્તા	અન્ય	ફરજો
૧૮.	જુનીયર કલાર્ક શિરસ્ટેદાર બ્રાંચ શ્રી કિસ્ટાઇન એસ ક્રિશ્યાન (ફાળવણી) એમલોઈ નં. ૭૩૧૧૦			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	આસી. મેનેજરશ્રી (સે.ઓફીસ) તથા શિરસ્ટેદારશ્રી (સેન્ટ્રલ ઓફીસ) ને સંબોધીને આવતી ખાતાકીય તથા સરકારી અરજીઓ, ટપાલ, તથા ફાઈલોનું ઈન્વર્ટ આઉટવર્ડ પોસ્ટેજ રજીસ્ટર તથા ઈન્ટરવ્યુ બ્રાંચની ટપાલની કામગીરી
૧૯.	શ્રી નેહાબેન પી ચાવડા જુ. બીલ કલાર્ક એમલોઈ નં. ૭૩૩૪૬ (ફાળવણી)			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સેન્ટ્રલ ઓફીસમાં ફરજ બજાવતા અધિકારીશ્રી / કર્મચારીઓના પગારના ટેટા ભરવાની, પગારબીલો પાસ કરાવી પેમેન્ટ કરવાની, ઈન્ક્ઝિપ્ટર કરવાની, રજીઓ અંગેના એસ. બી. એલ. આર કરવા તથા પરચૂરણ બિલો બનાવવાની કામગીરી
૨૦.	સીનીયર કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ શ્રી ફલગુની વાય. દેસાઈ એમલોઈ નં. ૮૬૮૮			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ચુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતાઓમાં જોયા ભરવા દૈનિક વર્તમાન પત્રમાં જાહેર ખબર દ્વારા તથા ખાતાકીય સરક્યુલર કરી મંગાવેલ અરજીઓ ઈન્વર્ટ કરવી, તેના પત્રકો બનાવવા
૨૧.	જુ.કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ શ્રી અંકિત કાન્પે એમલોઈ નં. ૭૨૮૩૨				(ટેક્ષ ખાતે ફાળવણી)
૨૨.	સીનીયર કલાર્ક (સંકલન વિભાગ બોર્ડ કમિટી વિભાગ) જોયા ખાલી			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ટાઉન પ્લાનીગ કમિટી, એસેટ કમિટી, હાઉસીગ કમિટી, રીકીએશન કમિટીમાં સંકલનની કામગીરી
૨૩.	સીનીયર કલાર્ક ઈમ્પ્રેશ કેશ શ્રી અપૂર્વ એમ વેધ એમલોઈ નં. ૭૦૮૫			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ચુનિસિપલ કમિશનરશ્રી તથા ડે.ચુનિસિપલ કમિશનરશ્રી દ્વારા કરવામાં આવતા તથા સેન્ટ્રલ ઓફીસ દ્વારા કરવામાં આવતા રોજ બરોજના ખર્ચની ચૂકવણી તથા સેન્ટ્રલ ઓફીસના કર્મચારીઓના મેડિકલ રીએમ્બર્સમેન્ટ બીલોની કામગીરી તથા ઈમ્પ્રેશ કેશ રજીસ્ટર નિભાવવું
૨૪.	સીનીયર કલાર્ક એસ્ટા.બ્રાંચ (ખાલી જોયા)			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ઇ માસ માટે હંગામી જોયા ઉધાડવાની કામગીરી તથા જગ્યાઓ કાયમ કરવા દરખાસ્તની કામગીરી તથા વર્ગ ૧ અને વર્ગ ૨ ના અધિકારી / કર્મચારીઓના પ્રોપર્ટી રીટનની માહીતી મંગાવવી ને ફોર્મ એક્સિટ કરવા
૨૫.	૩.શિરસ્ટેદાર (જનરલ) સીનીયર કલાર્ક શ્રી રજનીકાંત એસ.પેટેલ એમલોઈ નં. ૮૨૪૪			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	જુદી જુદી કેડરમાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ૪ ના અધિકારી / કર્મચારીઓના રજીનામા, સ્વે.નિવૃત્તિ, નામમાં ફેરફાર, અરજ ફોરવર્ડ, એન.ઓ.સી., વધુ અભ્યાસ, સ્ટડી લીવ, તથા વર્ગ ૪ ના કર્મચારીઓના બઢલી / બઢતી / નિમણૂંક અંગેની કામગીરી

અનુક્રમ	હોદ્દો / નામ / એમલોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંશાકીય સત્તા	અન્ય	ફરજો
૨૬.	૩.શિરસ્ટેદાર (ટેકનીકલ) સીનીયર કલાર્ક શ્રી અદ્યેશ એમ મહેતા એમલોઈ નં. ૮૬૬૨			ખાતાધિકારી તરફથી સૌપવામાં આવતી અન્ય કામગીરીઓ	ટેકનીકલ કેડરમાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ઉ ના અધિકારી / કર્મચારીઓના સર્વિસેટા, બદલી, નિમણૂંક બઢતી અંગેની કામગીરી
૨૭.	૩.શિરસ્ટેદાર (વહીવટ) સીનીયર કલાર્ક શ્રી ભરતભાઈ આઈ પટેલ એમ્પ.નં- ૮૪૦૫			ખાતાધિકારી તરફથી સૌપવામાં આવતી અન્ય કામગીરીઓ	વહીવટી કેડરમાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ઉ ના અધિકારી / કર્મચારીઓના સર્વિસેટા, બદલી, નિમણૂંક બઢતી અંગેની કામગીરી
૨૮.	સીનીયર કલાર્ક એ.સી.આર બ્રાંચ, એસ્ટા.બ્રાંચ તથા સરક્યુલર, ઓફિસાર્ડર શ્રી કલાવતી હરેન મહેતા એમલોઈ નં. ૮૩૫૮			ખાતાધિકારી તરફથી સૌપવામાં આવતી અન્ય કામગીરીઓ	ચુનિસિપલ કમિશનરશી તથા ૩.ચુનિસિપલ કમિશનરશી દ્વારા કરવામાં આવતા પરિપત્રો તથા ઓફિસ ઓર્ડર ઈસ્યુ કરવા તથા વેબસાઇટ ઉપર મુકાવવા તેમજ વર્ગ ૧ થી ઉ ના કર્મચારીઓના વર્ષવાઈજ વાર્ષિક ખાનગી અહેવાલ રીપોર્ટ નિભાવવા તથા ૩.ચુનિસિપલ કમિશનરશી દ્વારા બીજા વિભાગો (ખાતાકીય સિવાય) સાથે કરવામાં આવતા પત્રવ્યવહારનું આઉટવર્ક રજીસ્ટર તથા તેમના મોબાઇલ તથા ધરના ટેલીફોનના બીલોની બીલ બનાવી ચૂકવણી કરવાની કામગીરી ; છ માસ માટે હંગામી જગ્યા ઉધારવાની કામગીરી તથા જગ્યાઓ કાયમ કરવા દરખાસ્તની કામગીરી વર્ગ ૧ અને વર્ગ ૨ ના અધિકારી / કર્મચારીઓના પ્રોપર્ટી રીટર્નની માહીતી મંગાવવી ને ફોર્મ એક્સિટ કરવા
૨૯.	ટેડ કલાર્ક (સંકલન વિભાગ બોર્ડ કમિટી) ફાળવકી અન્ય ખાતે			ખાતાધિકારી તરફથી સૌપવામાં આવતી અન્ય કામગીરીઓ	સે.કમિટી, સ્ટાફ સિલેક્શન કમિટી, ઓડીટ સબ કમિટી અપીલ કમિટી ની સંકલનની કામગીરી તથા તેના ઠરાવો તથા મૂળજીએલ જુદા જુદા ખાતે આઉટવર્કની કામગીરી
૩૦.	૩.શિરસ્ટેદાર (હેલ્થ / હોસ્પિટલ) સીનીયર કલાર્ક શાહ કલ્પેશ ભોગીલાલ એમ્પ.નં-૮૧૬૮			ખાતાધિકારી તરફથી સૌપવામાં આવતી અન્ય કામગીરીઓ	હેલ્થ ખાતામાં તથા હોસ્પિટલોમાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ઉ ના અધિકારી / કર્મચારીઓના સર્વિસેટા, બદલી, નિમણૂંક બઢતી અંગેની કામગીરી
૩૧.	૩.શિરસ્ટેદાર (પોર્ટ ફોલીયો ) સીનીયર કલાર્ક મંગેશ આર તાવડે એમ્પ.નં-૮૭૮૮			ખાતાધિકારી તરફથી સૌપવામાં આવતી અન્ય કામગીરીઓ	સેન્ટ્રલ ઓફિસ દ્વારા ૩.ચુનિસિપલ કમિશનરશી તથા ચુનિસિપલ કમિશનરશી સમક્ષ જરૂરી મંજૂરી અર્થે મુકવામાં આવતી ફાઈલોનું ઈન્વર્ટ આઉટવર્ક તથા ડીપાર્ટમેન્ટલ પરીક્ષાનું આયોજન
૩૨.	સીનીયર કલાર્ક સંકલન વિભાગ બોર્ડ			ખાતાધિકારી તરફથી સૌપવામાં આવતી અન્ય	ટાઉન પ્લાનિગ કમિટી, એસેટ કમિટી, હાઉસીંગ કમિટી, રીકીએશન કમિટીમાં સંકલનની કામગીરી

અનુક્રમ	હોદ્દો / નામ / એમલોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંશાકીય સત્તા	અન્ય	ફરજો
	કમિટી શ્રી ધર્મશભાઈ શાહ એમલોઈ નં. ફેર્ડી			કામગીરીઓ	
૩૩.	સીનીયર કલાર્ક ઇન્ટરવ્યુ વિભાગ શ્રી અમરીશ એન. કાચરીયા એમલોઈ નં. ૮૪૬૦			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન ખાતાના જુદા જુદા ખાતાની જાહેર ખબરના અનુસંધાને આવેલ અરજીઓની લાયકાત મુજબ ચકાસણી કરવાની, તેમજ તે અંગે સક્ષમ સત્તાની મંજૂરી મેળવી ઇન્ટરવ્યુ ગોઠવવાની કામગીરી, ઇન્ટરવ્યુમાં આવેલ ઉમેદવારોના અસલ સર્ટિફિકેટ ચેક કરવાની કામગીરી, તેમજ ઇન્ટરવ્યુ બાદ સ્ટાફ સિવેકશન કમિટીની સૂચના મુજબ પસંદગીયાદી / પ્રતિક્ષાયાદી બનાવી સ્ટાફ સિવેકશન ઠરાવ પાડવાની કામગીરી તથા ઉમેદવારોને કોલ લેટર લખવાની તથા ખુનિસિપલ કોર્પોરેશનના દરેક કેડરના પ્રવિજનલ સીનીયોરોટી લીસ્ટ તથા ફાયનલ સીનીયોરોટી લીસ્ટ તૈયાર કરવાની કામગીરી
૩૪.	સીનીયર બીલ કલાર્ક શ્રી ઓમનારાયણ જી. તિવારી એમલોઈ નં. ૩૧૨૪૬			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	સેન્ટ્રલ ઓફિસની જરૂરીયાત મુજબની કન્નીજન્સી ઇન્ટેન્ટ ભરીને સેન્ટ્રલ સ્ટોર્સમાંથી લાવવાની, અધિકારી / કર્મચારીને કન્નીજન્સી જરૂરીયાત મુજબ રજીસ્ટરમાં નોંધ કરીને ઇચ્છુ કરવાની કામગીરી, પાર્ટિઓના બીલો માટે મંજૂરી લઈ બીલ બનાવી પેમેન્ટ કરવાની કામગીરી, રાજ્ય સરકારમાંથી ઉપ્યુટેશન ઉપર આવેલ ખુનિસિપલ કમિશનરશ્રી તેમજ ડે.ખુનિસિપલ કમિશનરશ્રીના પગારમાંથી કપાત કરવામાં આવેલ પ્રો.ફેડ, જી.આઈ.એસ, એચ.બી.એ, એચ.આર.આર વિગેરે ચિલણો બનાવી સરકારી ટ્રેઝરીમાં જમા કરવાની કામગીરી
૩૫.	જુનીયર કલાર્ક રજીસ્ટ્રી બ્રાંચ શ્રી મહાવીર ટી. રાહેદ એમલોઈ નં. ૭૨૧૯૮ અન્ય ખાતે ફાળવણી			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	ખુનિસિપલ કમિશનરશ્રી તથ ખુનિ.કાર્પાઉન્ડમાં ફરજ બજાવતા ડે.ખુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને આવતા ખાનગીપત્રો, મુખ્યમંત્રીશ્રીના પત્રો, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ નાપત્રો, સરકારીપત્રો, વિધાનસભાના તારંકીતપત્રો, પ્રભારી સંચિવ કલેક્ટરશ્રીના આવતા પત્રો, સ્વાગતમ માન્ય મુખ્યમંત્રીશ્રીના પત્રોનું ઇન્વર્ક આઉટવર્કની કામગીરી
૩૬.	જુનીયર કલાર્ક કોમ્પ્યુટર ઓપરેટર હેંમેટ ચલાણ એમલોઈ નં. ૭૨૬૦૮ જી.ડી.ઇએસટી.બ્રાચ અન્ય ખાતે ફાળવણી			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	સક્ષમ સત્તાની મંજૂરી મળ્યા બાદ વર્ગ ૧ થી ૪ ના કર્મચારીઓની નિમણૂંક, બદલી, બઢી, ફાળવણી, વધુ અભ્યાસ, નામમાં ફેરફાર, રાજનામા, સ્વે.નિવૃત્તિ, જી.ડી.ઇએસટી.નંબર પારી વેબસાઈટ ઉપર મુકવાની કામગીરી તથા કમ્પ્યુટરાઈઝ કરવાની કામગીરી
૩૭.	સીનીયર કલાર્ક રજીસ્ટ્રી બ્રાંચ			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય	ખુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને ખાતા દ્વારા જરૂરી મંજૂરી અર્થે આવતી ફાઈલોનું / પત્રોનું ઇન્વર્ક / આઉટવર્ક

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્પલોઈ નંબર	વહીવટી સત્તાઓ	નાંશાકીય સત્તા	અન્ય	ફરજો
	શ્રી પારુલ કે કોષ્ટી એમ્પલોઈ નં. ૮૮૪૫			કામગીરીઓ	
૩૮.	સીનીયર.કલાર્ક રજીસ્ટ્રી બ્રાચ શ્રી મનીષ પંચાલ એમ્પલોઈ નં. ૮૭૮૮			ખાતાવિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ખુનિસિપલ કમિશનરશી તથ ખુનિ.કમ્પાઉન્ડમાં ફરજ બજાવતા ૩.ખુનિસિપલ કમિશનરશીને સંબોધીને પોસ્ટ, કુરીયરથી આવતી અરજ / પત્રો, ખાતાકીય પત્રો, મેયરશી તથા ૩.મેયરશી તરફથી આવતા પત્રો, ચેરમેન સ્ટે.કમિટીશ્રીના પત્રોનું ઈન્વર્ડ આઉટવર્ડની કામગીરી
૩૯.	જુ.કલાર્ક રજીસ્ટ્રી બ્રાચ શ્રી મો આમીર એમ અભ્યાસી એમ્પલોઈ નં. ૮૭૯૨			ખાતાવિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ખુનિસિપલ કમિશનરશી તથ ખુનિ.કમ્પાઉન્ડમાં ફરજ બજાવતા ૩.ખુનિસિપલ કમિશનરશીને સંબોધીને પોસ્ટ, કુરીયરથી આવતી અરજ / પત્રો, ખાતાકીય પત્રો, મેયરશી તથા ૩.મેયરશી તરફથી આવતા પત્રો, ચેરમેન સ્ટે.કમિટીશ્રીના પત્રોનું ઈન્વર્ડ આઉટવર્ડની કામગીરી
૪૦.	જુ.કલાર્ક રજીસ્ટ્રી બ્રાચ શ્રી પ્રવિષ્ણુમાર એ સોલંકી એમ્પલોઈ નં. ૮૩૭૩			ખાતાવિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	૩.ખુનિસિપલ કમિશનર (ટેક્ષ) શ્રીને સંબોધીને ખાતા દ્વારા જરૂરી મંજૂરી અર્થે આવતી ફાઈલોનું / પત્રોનું ઈન્વર્ડ / આઉટવર્ડ
૪૧.	જુ.કલાર્ક કમ્પુટર જી.ડી.ઇએસ્ટી.બ્રાચ શ્રી જીશેશ આર.મોટી એમ્પલોઈ નં. ૮૮૨૫			ખાતાવિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સક્ષમ સત્તાની મંજૂરી મળ્યા બાદ વર્ગ ૧ થી ૪ ના કર્ભચારીઓની નિમણૂંક, બદલી, બઢી, ફાળવણી, વધુ અભ્યાસ, નામમાં ફરજાર, રાજીનામા, સ્વે.નિવૃત્તિ, જી.ડી.ઇએસ્ટી.નંબર પાડી વેબસાઈટ ઉપર મુકવાની કામગીરી તથા કમ્પુટરાઈઝ કરવાની કામગીરી
૪૨.	જુ. કોમ્પ્યુટર ઓપરેટર કમ્પુટર જી.ડી.ઇએસ્ટી.બ્રાચ શ્રી બીમલકુમાર કે રામપરીયા એમ્પલોઈ નં. ૭૨૬૦૭			ખાતાવિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સક્ષમ સત્તાની મંજૂરી મળ્યા બાદ વર્ગ ૧ થી ૪ ના કર્ભચારીઓની નિમણૂંક, બદલી, બઢી, ફાળવણી, વધુ અભ્યાસ, નામમાં ફરજાર, રાજીનામા, સ્વે.નિવૃત્તિ, જી.ડી.ઇએસ્ટી.નંબર પાડી વેબસાઈટ ઉપર મુકવાની કામગીરી તથા કમ્પુટરાઈઝ કરવાની કામગીરી
૪૩.	સીની કલાર્ક રોસ્ટર વિભાગ શ્રી પુંડાવાલા અફ્રોજબાનુ એમ્પલોઈ નં. ૮૪૮૭			ખાતાવિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ખુનિસિપલ કોપોરિશનના જુદા જુદા ખાતાની વર્ગ ૧ થી ૪ ની જગ્યાઓના રોસ્ટર રજીસ્ટર નિભાવવા, જાળવણી કરવી વખતો વખત થતી નિમણૂંક, રાજીનામા, બઢી મુશ્કુ વગેરેની નોંધ કરી રજીસ્ટર અપટે કરવા. તેમજ બેકલોગની જાહેર ખબર આપવી. નવી જગ્યો ભરવા રોસ્ટર અભિપ્રાય આપવા. રાજ્ય સરકાર દ્વારા રોસ્ટરને લગતી માહીતી માંગવામાં આવે તે માહીતી સમયસર પૂરી પાડવાની કામગીરી તેમજ રૂ.૧૦૦૦૦/- ની મર્યાદા


અનુક્રમ	હોદ્દો / નામ / એમ્બ્લોઈન નંબર	વહીવટી સત્તાઓ	નંશાકીય સત્તા	અન્ય	ફરજો
					સુધી અધિકારી / કર્મચારીને ખુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી મેળવી સેમીનારમાં મોકલવાની કામગીરી તેમજ સેમીનાર અંગે દરખાસ્ત કરવાની કામગીરી
૪૪.	જુ.કલાર્ક શ્રી રાહુલભાઈ પ્રાપ્તિ એમ્બ્લોઈન નં.૭૨૪૮૭ ફાળવણીથી નિમણુંક			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	રોડ પ્રોજેક્ટના ઓર્ડરો તથા સક્ષમ સત્તાની મંજૂરી મળ્યા બાદ વર્ગ ૧ થી ૪ ના કર્મચારીઓની નિમણુંક, બદલી, બઢતી, ફાળવણી, વધુ અભ્યાસ, નામમાં ફેરફાર, રાજનામા, સ્વૈ.નિવૃત્તિ, જી.ડી.ઇએસટી.નંબર પારી વેબસાઈટ ઉપર મુકવાની કામગીરી તથા કમ્પ્યુટરાઈઝ કરવાની કામગીરી
૪૫.	જુ.કલાર્ક શ્રી મનીષ ડી મોટી એમ્બ્લોઈન નં. ૮૫૬૩ ફાળવણીથી નિમણુંક			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	હેઠ્ય ખાતામાં તથા હોસ્પિટલોમાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ૩ ના અધિકારી / કર્મચારીઓના સર્વિસેટા, બદલી, નિમણુંક બઢતી અંગેની કામગીરી
૪૬.	જુ.કલાર્ક શ્રી વિપુલ પટેલ એમ્બ્લોઈન નં. ૮૫૬૬ ફાળવણીથી નિમણુંક			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	ટેકનીકલ કેડરમાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ૩ ના અધિકારી / કર્મચારીઓના સર્વિસેટા, બદલી, નિમણુંક બઢતી અંગેની કામગીરી
૪૭.	જુ.કલાર્ક(સીક્યુરીટી) શ્રી પિયુષ કે પારેખ એમ્બ્લોઈન નં ૪૨૦૦૬ ફાળવણીથી નિમણુંક			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	જુદી જુદી સીક્યુરીટી કંપનીના આવતા બીલોની પોઈન્ટ વાઈજ ચકસણી કરીને ખતવણી કરવાની કામગીરી, બીલોનું સ્ટેટમેન્ટ બનાવવાની કામગીરી, જરૂરીયાત મુજબ જે તે જગ્યાએ સીક્યુરીટી મુકવા તેમજ બંધ કરવા સીક્યુરીટી કંપનીને જાણ કરવા તેમજ એસેટ / ટી.ડી.ઓ ખાતા દ્વારા ગેરકાયદેસર બાંધકામ માટે મુકવામાં આવતી સીક્યુરીટી અંગેનો ચાર્જ વસૂલ લેવા અંગેની ગણતરી કરી ટી.ડી.ઓ / એસેટ ખાતાને જાણ કરવી.તેમજ બીલો બનાવવા.
૪૮.	જુ.કલાર્ક(સંકલન) શ્રી ડિરણભેન શાહ એમ્બ્લોઈન નં. ૮૩૪૨ ફાળવણીથી નિમણુંક			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	કમિટીની ફાઈલો ઈન્વર્ટ કરવા તથા ડિસ્પેચ કરવા તેમજ કમિટીઓ એટેન્ડ કરવાની કામગીરી
૪૯.	જુ. કોમ્પ્યુટર ઓપરેટર કમ્પ્યુટર જી.ડી.ઇએસટી.બ્રાચ શ્રી પ્રવિષ સાવલીયા એમ્બ્લોઈન નં. ૭૨૬૨૦ ફાળવણીથી નિમણુંક			ખાતાવિકારી તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરીઓ	સક્ષમ સત્તાની મંજૂરી મળ્યા બાદ વર્ગ ૧ થી ૪ ના કર્મચારીઓની નિમણુંક, બદલી, બઢતી, ફાળવણી, વધુ અભ્યાસ, નામમાં ફેરફાર, રાજનામા, સ્વૈ.નિવૃત્તિ, જી.ડી.ઇએસટી.નંબર પારી વેબસાઈટ ઉપર મુકવાની કામગીરી તથા કમ્પ્યુટરાઈઝ કરવાની કામગીરી

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્બલોઇટ નંબર	વહીવટી સત્તાઓ	નાંશાકીય સત્તા	અન્ય	ફરજો
૪૦.	સીનીયર કલાક - વેલ્ફેર બ્રાંચ શ્રી ગૌતમભાઈ ભાવસાર એમ્બલોઇટ નં. ૬૮૧૭ ફાળવણીથી નિમણું			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર વર્ગ ઉ અને વર્ગ ૪ ના કર્મચારીના આશ્રિતને રાજ્ય સરકારના નીતી નિયમો અનુસાર નાણાંકિય સહાય આપવા મંજૂરી મેળવવાની કામગીરી તથા મેનહોલ/ગલીટ્રેપ ખાતાના વર્ગ-૪ના કર્મચારીઓના મરણ/અનફિટ કેસમાં નોકરી આપવા અંગે
૪૧.	જુનીયર કલાક - વેલ્ફેર બ્રાંચ શ્રી લલીતભાઈ પટેલ એમ્બલોઇટ નં. ૮૮૩૨ ફાળવણીથી નિમણું			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર વર્ગ ઉ અને વર્ગ ૪ ના કર્મચારીના આશ્રિતને રાજ્ય સરકારના નીતી નિયમો અનુસાર નાણાંકિય સહાય આપવા મંજૂરી મેળવવાની કામગીરી તથા મેનહોલ/ગલીટ્રેપ ખાતાના વર્ગ-૪ના કર્મચારીઓના મરણ/અનફિટ કેસમાં નોકરી આપવા અંગે
૪૨.	જુ.કલાર્ક શ્રી સતીષ મોદી ઈન્ટરવ્યુ બ્રાંચ એમ્બલોઇટ નં. ૮૩૮૬ ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	૩. મ્યુનિસિપલ કમિશનાર (વહીવટ) શ્રીને સંબોધીને ખાતા દ્વારા જરૂરી મંજૂરી અર્થે આવતી ફાઈલોનું / પત્રોનું ઈન્વર્ટ / આઉટવર્ટ
૪૩.	સીની.કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ શ્રી નટુભાઈ પ્રજાપતિ એમ્બલોઇટ નં. ૮૮૫૩ ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	અરજદારની અરજાઓની ચકાસકી કરેલ પત્રક તથા સુધારા પત્રકની નવી નકલ સીની.કલાર્કને સુપ્રત કરવાની
૪૪.	જુ.કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ શ્રી સંજ્ય પટેલ એમ્બલોઇટ નં. ૭૨૮૨૪ ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	જાહેરખબરની નકલ એકાઉન્ટ ખાતામાં મોકલવી તથા જાહેરત રજીસ્ટર મેન્ટેનેન કરવું પસંગી/પ્રતિક્ષાયાદીના ઠરાવનું રજીસ્ટર મેન્ટેનેન કરવું.
૪૫.	જુ.કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ શ્રી કનુભાઈ વી ડેસાઈ એમ્બલોઇટ નં. ૮૬૦૮ ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	સીનીયોરીટી લીસ્ટ બનાવવા તથા આરટીઆઈ બાબતની કામગીરી
૪૬.	જુ.કલાર્ક ઈન્ટરવ્યુ બ્રાંચ શ્રી ભૌમિક શુક્લ એમ્બલોઇટ નં. ૭૨૮૩૩ ફાળવણીથી નિમણુંક			ખાતાધિકારી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરીઓ	ઉમેદવારોની અરજ અંગેના જવાબો, સરકારી પત્રોના જવાબો, મેરીટયાદી તૈયાર કરવી તેટા એન્ટ્રી તેમજ કમ્પ્યુટરને લગતી અન્ય કામગીરી

અનુક્રમ	હોદ્દો / નામ / એમ્બ્લોઈટ નંબર	વહીવટી સત્તાઓ	નાંશાકીય સત્તા	અન્ય	ફરજો
૪૭.	જુ.કલાર્ક ઇન્ટરવ્યુ બ્રાંચ શ્રી કિરણ પટેલ એમ્બ્લોઈટ નં. ૭૨૭૨૫ ફાળવણીથી નિમણુંક			ખાતાવિકારી તરફથી સૌપવામાં આવતી અન્ય કામગીરીઓ	અરજીપત્રકોના અલગ બંડલ બનાવી રેકર્ડ રૂમમાં વ્યવસ્થિત ગોઠવણી કરી તેની નોંધ રાખવી તેમજ વીજલન્સ ખાતા દ્વારા મંગાવવામાં આવતી માહિતી તૈયાર કરવી
૪૮.	જુ.કલાર્ક શ્રી રમીજ આર વોરા એમ્બ્લોઈટ નં. ૭૩૦૮૮ ફાળવણીથી નિમણુંક			ખાતાવિકારી તરફથી સૌપવામાં આવતી અન્ય કામગીરીઓ	સેન્ટ્રલ ઓફીસ દ્વારા ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી સમક્ષ જરૂરી મંજૂરી અર્થે મુકવામાં આવતી ફાઈલોનું ઠન્ડ આઉટવર્ક તથા ડે.શરસ્ટેદાર(હોસ્પીટલ-હેલ્પ)ની મદદમાં
૪૯.	ઝેરોક્ષ ઓપરેટર શ્રી નવીનભાઈ ગામેતી એમ્બ્લોઈટ નં. ૩૫૬૦૮ ફાળવણીથી નિમણુંક			ખાતાવિકારી તરફથી સૌપવામાં આવતી અન્ય કામગીરીઓ	ઝેરોક્ષ મશીન ઓપરેટીંગ ટેમજ તેના રીપેરીંગ અંગે જાણ કરવાની કામગીરી

3.

**અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન**  
**મ્યુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફિસ**  
**ફાઈલ / અરજીનો નિકાલ કરવા માટે નિર્ણય કરવાની પદ્ધતિ**



**અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન**  
**ખુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ**  
**પ્રકરણ - ૪ (નિયમ સંગ્રહ - ૩)**  
**કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સુચનાઓ**  
**નિયમસંગ્રહ અને દફતરો**

૪.૧ દસ્તાવેજનું નામ / મથાળું	-: અધિકારીઓ / કર્મચારીઓની મહેકમ અંગે કામગીરી
દસ્તાવેજનો પ્રકાર	-: દફતરો
દસ્તાવેજ પરનું ટુંકું લખાણ	-: મહેકમ સંબંધી
દફતરોની નકલ અહીંથી મળી શકશે	-: આસી.મેનેજર શ્રી, ખુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફીસ, અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન દાખાપીઠ અમદાવાદ ૧ ટેલીફોન નંબર ૨૪૭૯૮૯૯ થી ૧૮૧૮ એક્સ્ટેન્શન નંબર : ૫૪૪ ફેક્સ નંબર ૨૪૩૫૦૮૨૬
વિભાગ દ્વારા નિયમો, વિનિયમો, સુચનાઓ	-: ૧. અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશનના મહેકમ સંબંધી વિનિમયો ૨. મહાનગરપાલીકાના નિયમો ૩. રહેમરાહે નોકરીના નિયમો ૪. રોસ્ટરના નિયમો ૫. સ્ટે.કમિટી તથા ખુનિસિપલ કોર્પોરેશન બોર્ડના ઠરાવો. ૬. સીનીયોરિટી લીસ્ટ કેડરવાઈજ
નિયમ સંગ્રહ અને દફતરોની નકલ માટે લેવાતી ફી	-: નિયમોનુસાર



અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન  
 મુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફીસ  
 પ્રકરણ ૫ (નિયમ સંગ્રહ - ૪)

નીતી ધડતર અથવા નીતીના અમલ સંબધી જનતાના સત્યો સાથે  
 સલાહ - પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની  
 કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત

અનું નં	વિષય / મુદ્દો	શું જનતાની સહભાગીતા સનિયિત કરવાનું જરૂરી છે ? (હા / ના)	જનતાની સહભાગીતા મેળવવા માટેની વ્યવસ્થા
૧	મુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફીસની કામગીરી	ના	આ વિભાગની કામગીરી અધિકારી / કર્મચારીઓની મહેકમ સંબધીત કામગીરી છે જે આમ જનતાને સ્પર્શતી નથી.



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  
મ્યુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફિસ

૪.

રલ્સ / રેગ્યલેશન / સૂચનાઓ / મેન્યુઆલ / રેકર્ડ પેકી રાહવામાં આવતા રેકર્ડની માહીતી

અનુંન	વિગત	પ્રાપ્તિ સ્થાન
૧.	સરક્યુલર	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ સને જૂન ૨૦૦૩ મથી <a href="http://www.egovamc.com">www.egovamc.com</a> તથા ડીસે ૨૦૧૫ થી <a href="http://www.Ahmedabadcity.gov.in">www.Ahmedabadcity.gov.in</a> ઉપરથી મળી શકશે.
૨.	ઓફીસ ઓર્ડર	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ સને જૂન ૨૦૦૩ મથી <a href="http://www.egovamc.com">www.egovamc.com</a> તથા ડીસે ૨૦૧૫ થી <a href="http://www.Ahmedabadcity.gov.in">www.Ahmedabadcity.gov.in</a> ઉપરથી મળી શકશે.
૩.	જ.ડી.ઇમેસટી.ઠરાવો	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ સને જૂન ૨૦૦૩ મથી <a href="http://www.egovamc.com">www.egovamc.com</a> તથા ડીસે ૨૦૧૫ થી <a href="http://www.Ahmedabadcity.gov.in">www.Ahmedabadcity.gov.in</a> ઉપરથી મળી શકશે.
૪.	ફાયનલ તથા પ્રોવિઝનલ સીનીયોરીટી લીસ્ટ	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ સને જૂન ૨૦૦૩ મથી <a href="http://www.egovamc.com">www.egovamc.com</a> તથા ડીસે ૨૦૧૫ થી <a href="http://www.Ahmedabadcity.gov.in">www.Ahmedabadcity.gov.in</a> ઉપરથી મળી શકશે.
૫.	ભરતી સંબંધિત પરિણામો	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ સને જૂન ૨૦૦૩ મથી <a href="http://www.egovamc.com">www.egovamc.com</a> તથા ડીસે ૨૦૧૫ થી <a href="http://www.Ahmedabadcity.gov.in">www.Ahmedabadcity.gov.in</a> ઉપરથી મળી શકશે.

**અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશન**  
**ભૂનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફીસ**

પ્રકરણ ૬ (નિયમ સંગ્રહ ૫)

જહેર તંત્ર અથવા તેના નિયત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજની કક્ષાઓ અંગેનું પત્રક

અનુ નં	દસ્તાવેજની કક્ષા	દસ્તાવેજનું નામ અને તેની એક લીટીમાં ઓળખાશ	દસ્તાવેજ મેળવવાની કાર્યપદ્ધતિ	નીચેની વ્યક્તિ પાસે છે / તેના નિયત્રણમાં છે.
૧	દફ્તરો	અમદાવાદ મહાનગરપાલીકાના મહેકમ સંબંધી વિનિયમો	નિયમાનુસાર	શિરસ્તેદારશી ભૂનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફીસ
૨	દફ્તરો	અમદાવાદ મહાનગરપાલીકાના વર્ગ ૧ થી ૪ ના કર્મચારીઓના નિમણૂંક / બદલી / બઢતી / ફાળવણી / તેમજ અન્ય હુકમો (વર્ગ ૪ માં હેલ્થ તેમજ ઈજનેર ખાતા સિવાય )	“	શિરસ્તેદારશી ભૂનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફીસ
૩	દફ્તરો	અમદાવાદ મહાનગરપાલીકાના ભૂનિસિપલ કમિશનરશી તથા ડે.ભૂનિસિપલ કમિશનર(વહીવટ) શ્રી દારા કરવામાં આવતા સરકારીય સહાય ચુકવવાના નિયમો	“	શિરસ્તેદારશી ભૂનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફીસ
૪	દફ્તરો	રહેમરાહે નોકરીના નિયમો (સરકારશીના નિયમો મુજબ) તથા ઉચ્ચક નાણાંકિય સહાય ચુકવવાના નિયમો	“	વેલ્ડેરઓફીસરશી ભૂનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફીસ
૫	દફ્તરો	રોસ્ટરના નિયમો (સરકારશીના નિયમો મુજબ)	“	શિરસ્તેદારશી ભૂનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફીસ
૬	દફ્તરો	ભૂનિસિપલ કોર્પોરેશન તથા સ્ટે.કમિટી દારા કરવામાં આવતા ઠરાવો મુજબ અમલીકરણ	“	સંકલન અધિકારીશી (બોર્ડ - કમિટી વિભાગ / રોસ્ટર)
૭	દફ્તરો	સીનીયોરીટી લીસ્ટ કેડરવાઈઝ	“	ઓફીસ સુપ્રિ.શી ભૂનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફીસ



**અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન, મુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફિસ  
પ્રકરણ ૧૦ : અધિકારીઓ અને કર્મચારીઓની માહીતી - પુસ્તિકા : (ડિરેક્ટરી)**

અનુ નં	એમ્પ્લોઈ નંબર	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઇમેઇલ	સરનામું
				ક્રેચેરી	મોબાઇલ	ઘર			
૧.	૧૩	શ્રી. મુકુશ કુમાર આર્થ. એ. એસ	મુનિસિપલ કમિશનર	૨૫૩૫૪૮૮૮	---		---	--	
૨.	૧૭૬	શ્રી એસ. એમ ખત્રી આર્થ. પી. એસ	૩. મુનિસિપલ કમિશનર (જનરલ.)	૨૫૩૮૯૮૯૧/ એક્સ ૪૦૬	૭૫૬૭૦૫૦૨૦૭				૭૩-૩ ગેટનં ૨ આયોગન નગર ધરણીધર દેસારસ ની બાજુમાં અમદાવાદ
૩.	૧૭૭	શ્રી આર. બી. બારડ આર્થ. એ. એસ	૩. મુનિસિપલ કમિશનર (પ. જોન/એસ્ટેટ)	૨૭૫૫૩૫૭૫/ ૪૬૩	૭૫૬૭૦૩૮૮૮૮		૨૫૩૫૮૯૯૪		૩૦૫૪, સુયકૃત ટાવર, સંભવ પ્રેસની બાજુમાં જજીસંગલો રોડ અમદાવાદ ૩૫
૪.	૧૭૪	શ્રી સી. આર. ખરસાંધ, આર્થ. એ. એસ	૩. મુનિસિપલ કમિશનર (દ. જોન/હેલ્પ/વહીવટ/ )	૨૫૪૬૨૨૫૨ ૨૫૪૬૫૨૫૫ એક્સ ૩૧૮.૩૨૫ ૩૨૮૮૧૫૮૪	૮૪૬૮૨૩૩૧૧૧				૩. મુનિસિપલ કમિશનર બંગલો, લો ગાડન સામે, અમદાવાદ
૫.	૧૭૫	શ્રી ડી એચ શાહ , આર્થ. એ. એસ	૩. મુનિસિપલ કમિશનર (મ. જોન)	૨૫૩૮૯૮૯૧/ એક્સ ૪૦૮	૮૦૮૮૦ ૮૨૨૨૨				૧૦, એ શુભમ સોસાયટી, વિજય કોસીગ રોડ, અમદાવાદ
૬.	૧૭૮	શ્રી કે એલ બચાણી, જી એ એસ	૩. મુનિસિપલ કમિશનર (૩. જોન)	૨૨૮૦૦૮૦૩ ૨૨૮૪૨૮૨૬	૮૦૮૮૮૮૮૫૮૮				
૭.	૧૮૦	શ્રી ડી એ શાહ, જી. એ. એસ	૩. મુનિસિપલ કમિશનર (નવા પ. જોન)	૨૬૮૪૧૨૦૧	૮૮૨૫૫ ૨૨૨૨૫				
૮.	૧૮૧	શ્રી જે એસ પ્રજાપતિ જી. એ. એસ	૩. મુનિસિપલ કમિશનર (પુર્વજોન)		૮૮૨૫૫ ૨૨૨૨૪				
૯.	૨૬૫૭	શ્રી ડી. એસ. ગોર	૩. મુનિસિપલ કમિશનર (પુર્વજોન/સ્નાનાગાર)	૨૫૩૫૪૩૮૩ ૩૨૮૮૨૩૮૫	૮૩૨૭૦૩૮૭૨૦	૨૭૫૪૩૪૧૬			પ્રભા કોલોની, પોસ્ટ નવજીવન, ઉસ્માન પુરા, અમદાવાદ- ૧૪
૧૦.	૧૦૩૮	શ્રી આર્જવભાઈ જે. શાહ	૩. મુનિસિપલ કમિશનર (ફાયનાન્સ/લાનીગ/એ એમટીએસ)	૨૨૧૭૩૫૮૧	૮૩૨૭૦૩૮૮૨૪	૨૭૪૬૬૩૧૮			૧૫, સર્મથ કો. એ. સો. લી., મેમનગર તળાવ પાસે, મેમનગર, અમદાવાદ
૧૧.	૧૬૬	શ્રી વિશાલ બી. ખનામા	આર્સી. મ્યુ. કમિશનર (દ. જોન)		૮૩૭૭૫૮૮૮૪૮				૩૮, શાયોના દર્શન બંગલોઝ, ગુજરાત હાઈકોર્ટ સામે, ઘાટલોડીયા, અમદાવાદ
૧૨.	૧૬૮	શ્રી પટેલ સૌરભ	આર્સી. મ્યુ. કમિશનર		૮૩૭૭૪૦૮૬૭૪				૪૦૨, મનબીજ ફ્લેટ, સીપીનગર

અનુ નં	એમલોઈ નંબર	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઇમેઇલ	સરનામું
				કચેરી	મોબાઇલ	ધર			
		દિલીપભાઈ	(પ.જોન)						સામે, ઘાટલોડીયા, અમદાવાદ
૧૩.	૧૬૮	શ્રી શાહ પરાગ વિનોદકુમાર	આરી.ચુ.કમિશનર (૩.જોન)		૮૩૭૭૫૮૮૮૫૭				૧૧, પાયલપાર્ક સોસાયટી, સ્થાર ઇન્ડીયા બજાર પાસે, સેટેલાઈટ રોડ, અ-વાદ.
૧૪.	૧૭૦	શ્રી ભંડારી તેજસ જી.	આરી.ચુ.કમિશનર (નવા પ.જોન)		૮૩૭૭૪૦૮૬૮૨				૧૧, પાયલપાર્ક સોસાયટી, સ્થારબજાર પાસે, સેટેલાઈટ, અમદાવાદ
૧૫.	૧૭૧	શ્રી ભહુ રમ્યકુમાર વી.	આરી.ચુ.કમિશનર (મ.જોન/સિક્યુરિટી)		૮૩૭૭૪૦૮૬૪૬				સી/ડ, ભાસ્કર એપાર્ટમેન્ટ, એસ બીઆઈ કવાટર્સ, મીરામ્બીકા સ્ક્રેલ રોડ, નારણપુરા, અમદાવાદ
૧૬.	૭૦૨૨૮	શ્રી નિલેખભાઈ સી પટેલ	આરી.મેનેજર	૨૫૩૮૯૮૯૧ એક્સ.૫૪૪	૮૩૨૭૫૫૪૮૦૩		૨૫૩૨૮૬૮૮	centraloffic e@ahmeda badcity.gov .in	
૧૭.	૭૦૨૪૫	શ્રી કિરણકુમાર જે વનાલીયા	આરી.મેનેજર	૨૫૩૮૯૮૯૧ એક્સ.૭૩૦	૮૩૨૭૫૫૫૨૧૮		૨૫૩૨૮૬૮૮	"	
૧૮.	૮૬૬૪	શ્રી ભરતભાઈ આર સોલંકી	શિરસ્ટેટાર (ઓફિસ સુપ્રીટેન્ડન્ટ)	૨૫૩૮૯૮૯૧ એક્સ.૫૪૮	૮૮૭૮૦૩૧૭૬૮			"	
૧૯.	૮૦૫૧	શ્રી કંતિભાઈ બી પ્રજાપતિ	સંકલન અધિકારી (બોર્ડ - કમિટી)	૨૫૩૮૯૮૯૧ એક્સ.૫૪૫	---			"	
૨૦.	૮૫૭૮	શ્રી રઘજભાઈ એન પાંડોર	વેલ્ડેર ઓફિસર	૨૫૩૮૯૮૯૧ એક્સ.૫૮૮	૮૮૮૮૦૦૪૪૪૮			"	
૨૧.	૮૪૬૮	શ્રી વિજયભાઈ આર પટેલ	ઓ.એસ.	૨૫૩૮૯૮૯૧ એક્સ.૭૩૦	૮૮૭૮૦૩૧૭૬૮			"	
૨૨.	૮૫૩૦	શ્રી દુર્લભભાઈ જે ચોથરી	ટેડ કલાર્ક	૨૫૩૮૯૮૯૧ એક્સ.૪૫૬					
૨૩.	૮૮૮૮	શ્રી મનહરભાઈ એમ રાઠવા	ટેડ કલાર્ક ઇન્ટરવ્યુ બ્રાંચ	૨૫૩૮૯૮૯૧ એક્સ.૪૩૩					
૨૪.	૮૬૬૮	શ્રીમતી ફાલગુની વાય. દેસાઈ	સીનીયર કલાર્ક ઇન્ટરવ્યુ બ્રાંચ						
૨૫.	૭૩૧૧૦	કિસ્ટાઈન એસ. કિશ્યયન	જુનીયર કલાર્ક						
૨૬.	૮૬૩૭	શ્રીમતી ભુમિકા પી દેસાઈ	જુનીયર કલાર્ક શિરસ્ટેટાર રજીસ્ટ્રી બ્રાંચ						
૨૭.	૭૨૮૩૨	શ્રી અંકિત કાન્ડે ટેક્ષ ખાતે ફાળવણી	જુ.કલાર્ક ઇન્ટરવ્યુ બ્રાંચ						

અનુ નં	એમલોઈ નંબર	નામ	હોદ્ડો	ફોન નંબર			ફેક્સ	ઇમેઇલ	સરનામું
				ક્રચેરી	મોબાઇલ	ધર			
૨૮.	૭૨૧૯૩	શ્રી મહાવીર ટી. રાઠોડ વેલ્યુએશન ખાતે ફાળવણી	જુ.કલાર્ક રજીસ્ટ્રી બ્રાંચ	૨૫૩૮૯૮૯૧ એક્સ.૭૧૦					
૨૯.	૭૦૮૫	શ્રી અપૂર્વ એમ વૈથ્ય	સીનીયર કલાર્ક ઇમ્પ્રેશ કેશ						
૩૦.	૮૨૪૨	શ્રી રજનીકાંત એચ પટેલ	સીનીયર કલાર્ક ૩.શિરસ્ટેદાર (જનરલ)						
૩૧.	૮૧૬૧	શ્રી વિજય કે પંડ્યા	ઇન્યાજ હેડ કલાર્ક (જનરલ)	૨૫૩૮૯૮૯૧ એક્સ.૪૫૬					
૩૨.	૮૩૪૮	શ્રી કલાવતી હરેન મહેતા	સીનીયર કલાર્ક એ.સી.આર બ્રાંચ તથા સરક્યુલર, ઓફિસાર્ડર						
૩૩.	૮૧૬૮	શાહ કલ્પેશ ભોગીલાલ	૩.શિરસ્ટેદાર (હેલ્પ / ઇન્સ્પિટલ ) સીનીયર કલાર્ક						
૩૪.	૬૮૨૦	શ્રી શૈલેષ કે. મોટી	સીનીયર કલાર્ક સીક્યુરિટી બ્રાંચ	૨૫૩૮૯૮૯૧ એક્સ.૫૮૬					
૩૫.	૮૭૫૬	શ્રી મંગેશ તાવડે	સી.કલાર્ક પાટફાલીયો						
૩૬.	૭૩૩૪૬	નેહા એન ચાવડા	જુ.કલાર્ક ફાળવણી						
૩૭.	૮૫૬૮	શ્રી ધર્મશ આર શાહ	સીનીયર કલાર્ક સંકલન વિભાગ બોર્ડ કમિટી	૨૫૩૮૯૮૯૧ એક્સ.૫૪૫					
૩૮.	૮૪૬૦	શ્રી અમરીશ કાચરીયા	સીનીયર કલાર્ક ઇન્ટરવ્યુ વિભાગ	૨૫૩૮૯૮૯૧ એક્સ.૬૫૦					
૩૯.	૩૧૨૪૬	શ્રી ઓમનારાયણ તિવારી	સીનીયર બીલ કલાર્ક	૨૫૩૮૯૮૯૧ એક્સ.૭૫૮					
૪૦.	૮૮૪૫	શ્રી પારુલબેન કે કોણ્ટી	સીનીયર કલાર્ક કમિશનરશીની ઓફિસ ઇન્વર્ટ	૨૫૩૮૯૮૯૧ એક્સ.૪૨૨					
૪૧.		શ્રી મો આમીર એમ અભાસી	જુ.કલાર્ક રજીસ્ટ્રી બ્રાંચ	૨૫૩૮૯૮૯૧ એક્સ.૭૧૦					
૪૨.	૮૩૭૩	શ્રી પ્રવિષ્ણુકુમાર એ સોલંકી	જુ.કલાર્ક રજીસ્ટ્રી બ્રાંચ	૨૫૩૮૯૮૯૧ એક્સ.૫૧૧					
૪૩.	૮૪૬૭	શ્રી અફરોજબાનુ એ પુંખાવાલા	સીની કલાર્ક રોસ્ટર વિભાગ						
૪૪.	૬૦૩૧૪	શ્રી ગણેશ એ પટેલ	એટેન્ડન્ટ ક્રમ પ્રાઈવર						

અનુ નં	એમલોઈ નંબર	નામ	હોદ્ડો	ફોન નંબર			ફેક્સ	ઇમેઇલ	સરનામું
				કચેરી	મોબાઇલ	ધર			
૪૫.	૮૮૨૫	શ્રી જગેશ આર. મોટી જ.રી.ઇએસ્ટી.બ્રાચ	જુ.કલાર્ક કમ્પ્યુટર						
૪૬.	૭૨૬૦૭	શ્રી બીમલ કે રામપરીયા	જુ.કમ્પ્યુટર ઓપરેટર જ.રી.ઇએસ્ટી.બ્રાચ						
૪૭.	૮૫૬૩	શ્રી મનિષભાઈ મોટી	જુ.કલાર્ક ફાળવણી						
૪૮.	૮૫૬૬	શ્રી વિપુલ પટેલ	જુ.કલાર્ક ફાળવણી						
૪૯.	૪૨૦૦૬	શ્રી પિયુષ પારેખ	જુ.કલાર્ક ફાળવણી						
૫૦.	૮૩૪૨	શ્રી ડિરાણબેન શાહ	જુ.કલાર્ક ફાળવણી						
૫૧.	૭૨૬૨૦	શ્રી પ્રવિજા સાવલીયા	જુ.કમ્પ્યુટર ઓપરેટર ફાળવણી						
૫૨.	૬૮૧૭	શ્રી ગૌતમ બી. ભાવસાર	સીની.કલાર્ક ફાળવણી						
૫૩.	૮૩૮૬	શ્રી સતીષ મોટી	જુ.કલાર્ક ફાળવણી						
૫૪.	૮૮૫૩	શ્રી નટુભાઈ પ્રજાપતિ	સીનીયર કલાર્ક						
૫૫.	૭૨૮૨૪	શ્રી સંજ્ય પટેલ	જુ.કલાર્ક ફાળવણી						
૫૬.	૭૩૦૮૮	શ્રી રમીજ આર વોરા	જુ.કલાર્ક ફાળવણી						
૫૭.	૮૬૦૮	શ્રી કનુભાઈ વી દેસાઈ	જુ.કલાર્ક ફાળવણી						
૫૮.	૭૨૪૮૭	શ્રી રાહુલ પટેલ	જુ.કલાર્ક ફાળવણી						
૫૯.	૭૨૮૮૩	શ્રી ભોમિક શુક્લ	જુ.કલાર્ક ફાળવણી						
૬૦.	૭૨૭૨૫	શ્રી ડિરાણ પટેલ	જુ.કલાર્ક ફાળવણી						
૬૧.	૮૪૦૫	શ્રી ભરતભાઈ ચાઠા. પટેલ	સીની.કલાર્ક						
૬૨.	૮૬૬૨	શ્રી અલ્પેશ એમ. મહેતા	સીની.કલાર્ક						
૬૩.	૮૭૮૮	શ્રી મનીષ પંચાલ	સીનીયર કલાર્ક						
૬૪.	૮૮૩૨	શ્રી લલીત પટેલ	જુનીયર કલાર્ક						
૬૫.	૩૫૬૦૮	શ્રી નવીન ગામેતી	ટેલેક્ષન ઓપરેટર						
૬૬.	૩૫૫૪૧	શ્રી રામભાઈ ઓ ભીલ	નાયક						
૬૭.	૩૫૫૪૫	શ્રી બાબુભાઈ રી બરંડા	નાયક						
૬૮.	૪૧૨૨૪	શ્રી સોમાભાઈ એસ દેસાઈ	પટાવણા						
૬૯.	૩૮૨૪૩	શ્રી રોહિત બી ઠાકોર	પટાવણા						
૭૦.	૩૪૩૦૮	શ્રી ઈકબાલહુસૈન એમ. દિવાન	પટાવણા						
૭૧.	૩૪૧૯૭	શ્રી રામજી એ સાવ	પટાવણા						
૭૨.	૩૨૭૧૩	શ્રી હરીસિંહ જે સોદાયા	પટાવણા						
૭૩.	૩૨૮૨૭	શ્રી અબ્દુલરહેમાન એમ મોદન	પટાવણા						
૭૪.	૩૪૦૮૦	શ્રી રામજીભાઈ એમ	પટાવણા						

અનુ નં	એમલોઈ નંબર	નામ	હોદ્ડો	ફોન નંબર			ફેક્સ	ઇમેઇલ	સરનામું
				ક્રેરી	મોબાઇલ	ધર			
		વાધેલા							
૭૫.	૩૮૧૦૧	શ્રી ભાવેશ વી. દાતાણીયા	પટાવાળા						
૭૬.	૩૪૩૮૭	શ્રી અભુલરસીદ એ.કાદરભાઈ	પટાવાળા						
૭૭.	૩૪૩૮૮	શ્રી રામતીરથ માતાઠીન કોરી	પટાવાળા						
૭૮.	૩૪૬૦૮	શ્રી રમેશ જ.પ્રજાપત્ની	પટાવાળા						
૭૯.	૩૪૬૩૨	શ્રી જસવંત સી. બારીયા	પટાવાળા						
૮૦.	૩૪૮૮૬	શ્રી અશોક એસ લુધવાણી	પટાવાળા						
૮૧.	૩૬૦૦૮	શ્રી સ્યંયપ્રકાશ બી શ્રીમાર્ગી	પુજારી						
૮૨.	૩૪૪૮૬	શ્રી રાજેશકુમાર એચ લોધા	પટાવાળા						
૮૩.	૩૪૬૭૧	શ્રી હસમુખ એમ ભારી	પટાવાળા						
૮૪.	૩૪૬૭૭	શ્રી દેવેન્દ્ર પી મુખવા	પટાવાળા						
૮૫.	૩૪૭૧૮	શ્રી નરેન્દ્ર એમ ઠાકોર	પટાવાળા						
૮૬.	૩૬૦૦૩	શ્રી ભારતીબેન એમ ગોહેલ	એટેન્ડેન્ટ						
૮૭.	૩૬૦૦૪	શ્રી અશોકભાઈ પી રાઠોડ	એટેન્ડેન્ટ						
૮૮.	૩૬૦૦૫	શ્રી વિરેન્દ્રપ્રસાદ એસ કોરી	એટેન્ડેન્ટ						
૮૯.	૩૬૦૦૬	શ્રી નારાયણ એન તૈલી	એટેન્ડેન્ટ						
૯૦.	૩૮૧૩૭	શ્રી વિશાલ પી ભર્ણી	પટાવાળા						
૯૧.	૩૮૧૭૧	શ્રી ભિતેષ બી પરમાર	પટાવાળા						
૯૨.		મોહમદ અમીન અભુલસમદ શેખ	હેડ પ્રાયવર						
૯૩.	૫૮૦૭૬	શ્રી શંકરશિંહ એ ખારીશવત	પ્રાઇવર						
૯૪.	૩૨૮૮૫	શ્રી બાબુભાઈ વી પરમાર	પ્રાયવર						
૯૫.	૩૨૮૮૫	શ્રી ઠથુરભાઈ આર ટેસાઈ	પ્રાયવર						
૯૬.	૩૪૨૩૮	શ્રી ભરતભાઈ આઈ ઠાકોર	પ્રાયવર						
૯૭.	૫૮૭૮૮	શ્રી બળવંત ભીમરીંગ ગામીત	પ્રાયવર						
૯૮.	૩૪૮૨૬	શ્રી હીરાભાઈ જ વાધેલા	કલીનર						
૯૯.	૬૦૩૧૫	શ્રી હસમુખ બી નાયક	કલીનર						
૧૦૦.		જગ્યા ખાલી	હેડ વોચમેન						
૧૦૧.	૩૮૩૪૩	શ્રી સાજુદ્દીન એન. સીપાઈ	વોચમેન						
૧૦૨.	૩૮૩૪૫	શ્રી ભરતભાઈ સી. લોધા	વોચમેન						

અનુ નં	એપ્લોઈ નંબર	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઇમેઇલ	સરનામું
				ક્રેશી	મોબાઇલ	ધર			
૧૦૩.	૩૨૮૨૨	શ્રી રમેશચંદ્ર એમ પારેખ	વોયમેન						
૧૦૪.	૩૩૬૩૨	શ્રી બિસમીલા મિયાં એ સૈયદ	પગી						
૧૦૫.	૩૬૭૧૭	શ્રી કેતન વી ચાવડા	વોયમેન						
૧૦૬.	૮૭૦૬	શ્રી મુંશ એમ ચૌથરી	વોયમેન						



## અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફિસ

પ્રકરણ ૧૧ (નિયમ સંચાહ - ૧૦) વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પદ્ધતિ સહીત

દરેક અધિકારી અને કર્મચારી હોદ્દા મુજબ મળતું માસિક મહેનતાણું

અનુંન	હોદ્દો	પે.સ્કેલ + ગ્રેડ પે + ડી.એ ૧૨૫%
૧.	મ્યુનિસિપલ કમિશનર	૩૭૪૦૦ / ૬૭૦૦૦ + ૧૦૦૦૦ ગ્રેડ પે
૨.	૩.મ્યુનિસિપલ કમિશનર	૩૭૪૦૦ / ૬૭૦૦૦ + ૮૫૦ ગ્રેડ પે
૩.	૩.મ્યુનિસિપલ કમિશનર (રાજ્ય સરકારમાંથી પ્રતિનિયુક્તિ)	૧૫૬૦૦ / ૩૮૧૦૦ + ૭૬૦૦ ગ્રેડ પે
૪.	ઓફિસર ઓન સ્પે.ડ્યુટી	૧૫૬૦૦ / ૩૮૧૦૦ + ૭૬૦૦ ગ્રેડ પે
૫.	આસી.મ્યુનિસિપલ કમિશનર	૧૫૬૦૦ / ૩૮૧૦૦ + ૭૬૦૦ ગ્રેડ પે
૬.	આસી.મેનેજર	૬૩૦૦/૩૪૮૦૦ + ૫૪૦૦ ગ્રેડ પે
૭.	શિરસ્ટેદાર (ઓફિસ સુપ્રીટેન્દન્ટ), સંકલન અધિકારી, વેલ્કેર ઓફિસર , ઓ.એસ.	૬૩૦૦/૩૪૮૦૦ + ૪૬૦૦ ગ્રેડ પે
૮.	હેડકલાર્ક	૬૩૦૦ / ૩૪૮૦૦ +૪૨૦૦ ગ્રેડ પે
૯.	સીનીયર કલાર્ક	૫૨૦૦ / ૨૦૨૦૦ +૨૪૦૦ ગ્રેડ પે
૧૦.	જુ.કલાર્ક	૫૨૦૦ / ૨૦૨૦૦ +૧૯૦૦ ગ્રેડ પે
૧૧.	જુ.કોમ્પ્યુટર ઓપરેટર	૫૨૦૦ / ૨૦૨૦૦ +૧૯૦૦ ગ્રેડ પે
૧૨.	હેડડ્રાઇવર	૫૨૦૦ / ૨૦૨૦૦ +૨૪૦૦ ગ્રેડ પે
૧૩.	ડ્રાઇવર	૫૨૦૦ / ૨૦૨૦૦ +૧૯૦૦ગ્રેડ પે
૧૪.	એટેન્ડન્ટ	૪૪૪૦ / ૭૪૪૦ + ૧૩૦૦ ગ્રેડ પે
૧૫.	નાયક	૪૪૪૦ / ૭૪૪૦ + ૧૬૫૦ ગ્રેડ પે
૧૬.	પુઝારી	૪૪૪૦ / ૭૪૪૦ + ૧૬૫૦ ગ્રેડ પે
૧૭.	કલીનર	૪૪૪૦ / ૭૪૪૦ + ૧૩૦૦ ગ્રેડ પે
૧૮.	હેડ વોચમેન	૫૨૦૦ / ૨૦૨૦૦ + ૧૬૦૦ ગ્રેડ પે
૧૯.	વોચમેન	૪૪૪૦ / ૭૪૪૦ + ૧૩૦૦ ગ્રેડ પે
૨૦.	પગી	૪૪૪૦ / ૭૪૪૦ + ૧૩૦૦ ગ્રેડ પે
૨૧.	સીક્યુરિટી સુપ્રિન્ટેન્ટ	૬૩૦૦ / ૩૪૮૦૦ + ૫૪૦૦ ગ્રેડ પે
૨૨.	પટાવાળા	૪૪૪૦ / ૭૪૪૦ + ૧૩૦૦ ગ્રેડ પે



## અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મ્યુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફિસ

### પ્રકરણ ૧૨ : (નિયમ સંગ્રહ ૧૧) પ્રત્યેક સંસ્થાને ફાળવાયેલ અંદાજપત્ર

તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલ ચૂકવણી અંગે અહેવાલોની વિગતો વિકાસ, નિર્માણ અને તકનીકી કાર્યો અંગે જવાબદાર જાહેરતંત્ર માટે ૧૨.૧ જુદી જુદી યોજનાઓ  
અન્વયે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે અંદાજપત્રની વિગતોની માહીતી

### મ્યુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફિસ

પગાર ખર્ચની ( વર્ષ-૨૦૧૬-૧૭ )

### ૧૦૩ મ્યુનિસિપલ કમિશનરશીનું પર્સનલ

બજેટ કોડ નંબર	બજેટ હેડ	સૂચિત અંદાજપત્ર	મંજુર થયેલ અંદાજપત્ર	તા. ૩૦.૦૬.૧૬ સુધી થયેલ ખર્ચ	બાકી રહેલ ખર્ચ
૩૦૧૯૯	પગાર ખર્ચ	-	૨૦.૯૧	૪.૪૮	૧૬.૪૨
૩૪૮૨૦	ડીસ્કીશનલ કન્ટીજન્સી	-	૨૦.૦૦	૧.૮૪	૧૮.૧૪



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મ્યુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફિસ

પ્રકરણ ૧૨ : (નિયમ સંગ્રહ ૧૧) પ્રત્યેક સંસ્થાને ફાળવાયેલ અંદાજપત્ર

તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને કરેલ ચૂકવણી અંગે અહેવાલોની વિગતો વિકાસ, નિર્માણ અને તકનીકી કાર્યો અંગે જવાબદાર જાહેરતંત્ર માટે ૧૨.૧ જુદી જુદી યોજનાઓ અન્વયે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે  
અંદાજપત્રની વિગતોની માહીતી

૧૦૪ મ્યુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફિસ

બજેટ કોડ નંબર	બજેટ હેડ	સૂચિત અંદાજપત્ર	મંજુર થયેલ અંદાજપત્ર	તા. ૩૦.૦૬.૧૬ સુધી થયેલ ખર્ચ	બાકી રહેલ ખર્ચ
૩૦૧૮૮	૫૦૫૨ ખર્ચ	-	૫૩૦.૮૦	૧૩૦.૭૧	૪૦૦.૦૬
૩૦૪૦૧	યુનીઝોર્મ	-	૨.૫૦	૦.૦૦	૨.૫૦
૩૪૧૦૧	ટેલીફોન નથા ટ્રેકકોલ	-	૧૨.૦૦	૨.૧૨	૮.૮૮
૩૪૧૦૨	પોસ્ટેજ તથા ટેલીગ્રામ	-	૨.૦૦	૦.૧૫	૧.૮૫
૩૪૧૦૩	મેમ્બરશીપ ફી	-	૩.૦૦	૦.૦૦	૩.૦૦
૩૪૨૨૦	સીટી મેનેજર્સ એસોસીયેશન	-	૩.૪૦	૦.૧૧	૩.૪૦
૩૪૪૦૧	સ્ટેશનરી	-	૩.૦૦	૦.૩૪	૨.૬૬
૩૪૪૦૪	ગ્રીન્ટીગ	-	૨.૫૦	૦.૦૦	૨.૫૦
૩૪૫૦૨	મુસાફરી ખર્ચ	-	૩૦.૦૦	૧.૭૮	૨૮.૨૧
૩૪૮૦૬	સીક્યુરીટી ખર્ચ	-	૧૬૬૮.૮૦	૨૧૫.૮૮	૧૬૪૨.૮૨
૩૪૮૦૮	પુસ્તકો અખબારો, સામયિકો, રમકડા	-	૦.૪૦	૦.૦૦	૦.૪૦
૩૪૮૧૩	ગોળખપત્રો	-	૦.૨૦	૦.૦૦	૦.૨૦
૩૮૭૦૭	સંદેશા વ્યાહવારના સાધનો, ટેલીફોન વાયરલેસ	-	૫.૦૦	૦.૬૨	૪.૩૮
૩૬૦૦૧	ટેબલ ખુરશી	-	૨.૦૦	૦.૦૦	૨.૦૦
૩૪૮૮૮	અન્ય ખર્ચ	-	૨૫.૦૦	૨.૮૬	૨૨.૧૪
૩૪૩૦૩	મોટર તથા ટ્રાન્સપોર્ટ	-	૧૦.૦૦	૦.૭૩	૯.૨૭
૩૬૨૦૧	વાહન ખર્ચ	-	૮.૦૦	૧.૧૪	૬.૮૬
૪૩૨૦૧	પેટ્રોલ ડીજલ ખર્ચ	-	૨૭.૦૦	૪.૧૪	૨૨.૮૬



**અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન**  
**મ્યુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફિસ**

જાહેર માહીતી અધિકારીશ્રી ના નામ, હોદ્ડો અને અન્ય માહીતી

મ્યુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફિસના અપીલ અધિકારી / જાહેર માહીતી અધિકારી / મદદનીશ માહીતી અધિકારીશ્રીની વિગતો

ક્રમ	સેન્ટ્રલ ઓફિસના વિભાગનું નામ	જાહેર માહીતી અધિકારી	અપીલ અધિકારી
૧	શિરસ્તેદારબાંધ, હેડ કલાર્ક (જનરલ) બ્રાંથ, રજીસ્ટ્રી બ્રાંથ, સંકલન વિભાગ (બોર્ડ / કમિટી), રોસ્ટરવિભાગ, હેડશ્રાઇવર વિભાગ, કંટ્રોલરુમવહીવટી બાબતો માટે (મોનસુન કંટ્રોલરુમ સિવાય)	શ્રી નિલેષ સી પટેલ મ્યુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફિસ, સી-બ્લોક પ્રથમ માળ, સરદાર પટેલ ભવન દાણાપીઠ, અમદાવાદ. centraloffice@egovamc.com (ઓ) ૨૫૩૮૧૮૧૧ (૫૪૪) (મો) ૯૮૨૭૫ ૫૪૮૦૩	શ્રી રમ્યકુમાર ભંડ આસી મ્યુનિસિપલ કમિશનર (મધ્યઝોન)  આસી મ્યુનિસિપલ કમિશનર (મ.ઝોન) શ્રીની ઓફિસ  બી બ્લોક, નવુ બિલ્ડીંગ ગ્રીજો માળ, સરદાર પટેલ ભવન, અ.મ્યુ.કોર્પોરેશન દાણાપીઠ અમદાવાદ ramyabhatt@egovamc.com (ઓ) ૨૫૩૮૧૮૧૧ (૭૫૪) (મો) ૯૩૭૭૪ ૦૮૬૪૬
૨	ઈન્ટરવ્યુ બ્રાંથ, વેલ્ડર બ્રાંથ, સિક્યુરિટી બ્રાંથ તેમજ સેમીનાર તાવીમ, બીલ કલાર્ક અને ઈમ્પ્રેશ કેશ વિભાગ, વોચમેન બ્રાંથ	શ્રી કિરણ વનાલીયા મ્યુનિસિપલ કમિશનરશીની સેન્ટ્રલ ઓફિસ, સી-બ્લોક પ્રથમ માળ, સરદાર પટેલ ભવન દાણાપીઠ, અમદાવાદ. kiranvanaliya@egovamc.com (ઓ) ૨૫૩૮૧૮૧૧ (૭૩૦) (મો) ૯૮૨૭૫ ૫૫૨૧૮	

સેન્ટ્રલ ઓફિસના જે તે વિભાગની માહીતી માટે જે તે વિભાગના જાહેર માહીતી અધિકારીશ્રીને સંબોધિને અરજી કરવાની રહેશે.